

G.I.D.C., Makarpura, P.B.No.: 719, Vadodara-390 010, Gujarat- India.

Phone: (0265) 2642661

ISO 9001: 2015 & ISO 14001: 2015 & ISO 45001:2018 Certified Company

May 20, 2024

To,
The Manager
Department of Corporate Services
The Bombay Stock Exchange Ltd
Phiroz Jeejeebhoy Towers, 14th Floor
Dalal Street, Fort
MUMBAI - 400 001

scrip Code: 504093

Subject.: Regulation 30 read with Schedule III to the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of Listing Regulations, please find enclosed copies of notices given to shareholder in accordance with the applicable provision of the Listing Regulations and the Companies Act, 2013 read with rules made thereunder, inter alia, informing them about the transfer of all such shares in respect of which dividend has not been claimed for seven consecutive years to Investor Education and Protection Fund (IEPF). The Notice was published in the following Newspapers on 15th May, 2024:

- i) Business Standard (English) and
- ii) Loksatta (Vernacular)

This is for your information and record.

Thanking You.

Yours Truly,
For Panasonic Energy India Co. Ltd.

Sraban Kumar Karan
Company Secretary

Encl.: As Below

Aadhar Housing Finance Ltd.

Corporate Office: Unit No.802, Natraj Rustomjee, Western Express Highway and M.V.Road, Andheri (East), Mumbai-400069
Morbi Branch: Office No. 401, 4th Floor, Vakhat Complex, Vasant Plot, Ravapur Road, Opp. Chakhiya Hanuman, Morbi - 363641 (GJ).



E- AUCTION – SALE NOTICE

E-Auction Sale Notice for Sale of immovable Properties under the Securitization and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged, possession of which has been taken by the Authorised Officer of Aadhar Housing Finance Limited will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" with no known encumbrances Particulars of which are given below:-

Sr. No.	Borrower(s) / Co-Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date & Amount	Description of the Immovable property	Reserve Price (RP)	EMD (10% of RP)	Nature of possession
1	(Loan Code No. 14810000549/ Morbi Branch) Kalubhai Dayabhai Vaghela (Borrower), Sonalben Kalubhai Vaghela (Co-Borrower)	11-07-2023 & ₹ 12,96,555/-	All that part & parcel of property bearing, GF and FF Block No. K-1 Manas Dham-2 Jetpar Road Plot No. 15/P Pipali Morbi Gujarat - 363642 Boundaries : East - Block No. L 7, West - Road, North - Block No. K.2, South - Block No. J 7	Rs. 8,75,700/-	Rs. 87,570/-	Physical

- Last Date of Submission of DD of Earnest Money Deposit along with KYC, Tender Form and accepted Terms and conditions (Tender Documents) is **14-06-2024 within 5:00 PM** at the Branch Office address mentioned herein above or uploaded on <https://bankeuctions.com>. Tenders documents received beyond last date will be considered as invalid tender and shall accordingly be rejected. No interest shall be paid on the EMD.
- Date of Opening of the Bid/Offer (Auction Date) for Property is **15-06-2024 on https://bankeuctions.com at 03:00 PM to 04:00 PM**.
- AHFL is not responsible for any liabilities whatsoever pending upon the property as mentioned above. The Property shall be auctioned on "As is Where is Basis", "As is What is Basis" and "Whatever is There is Basis".
- The Demand Draft Should be made in favor of "Aadhar Housing Finance Limited" Only.
- Auction/bidding shall be only through "Online Electronic Bidding" through the website <https://bankeuctions.com>. Bidders are advised to go through the website for detailed terms before taking part in the e-auction sale proceedings.
- The intending bidders should register their names at portal **M/s C 1 INDIA PVT LTD** through the link <https://bankeuctions.com/registration/signup>, and get their User ID and password free of cost. Prospective bidder may avail online training on E- auction from the service provider **M/s C 1 INDIA PVT LTD** through the website <https://bankeuctions.com>.
- For further details contact Authorised Officer of Aadhar Housing Finance Limited, **Amitkumar Soni, Contact No. 9913333214** OR the service provider **M/s C 1 INDIA PVT LTD, Mr. Prabhakaran, Mobile No: +91-74182-81709, E-mail:tn@c1india.com & support@bankeuctions.com, Phone No. +917291981124 /25 /26**. As on date, there is no order restraining and/or court injunction AHFL the authorized Officer of AHFL from selling, alienating and/or disposing of the above immovable properties/secured assets.
- For detailed terms and conditions of the sale, please refer to the link provided in Aadhar Housing Finance Limited (AHFL), secured creditor's website i.e. www.aadharhousing.com.
- The Bid incremental amount for auction is **Rs. 1000/-**.

Place : Gujarat
Date : 15.05.2024

Sd/- Authorised Officer
Aadhar Housing Finance Limited

PUBLIC NOTICE

Notice is hereby given to the public that the Industrial Lease Hold Immovable property namely, being Industrial Plot No. 87/1/C, having Plot area admeasuring 560 Sq. Mtrs. with construction of Industrial Nature, there on admeasuring 334.44 sq. mtrs. in the scheme known as "Vatva Industrial Estate - Phase-I", of the land owner GIDC, which is situate lying and being over the Lease hold Land of the Revenue Survey No. 479 and 480, in the sim of Mouje Village - Vinzol, Taluka - Vatva, Dist- Sub-Dist- Ahmedabad-11 (Aslali), which is at present in the name and / ownership / Lease hold rights of M/s. Energy Mission Engineers through its sole proprietor Satisbhhai Kanjibhai Parmar, but the original documents of the aforesaid property namely (1) Registered Lease Deed executed between GIDC and M/s. Unique Erectors a Partnership Firm, dated: 07/04/1972, (27/09/1972) Reg. No. 4692, with original R.R. (2) Original Reg. Deed of Assignment executed by M/s. Unique Erectors a Partnership Firm in favour of Unique Erectors (Guj) Pvt. Ltd., dated 28/06/1973, Reg. No. 7102, with original R.R., (3) Original Reg. Deed of Assignment-cum-Conveyance Deed executed by Unique Erectors (Guj) Pvt. Ltd. in favour of M/s. Mission Engineers a Proprietorship Firm, dated 17/06/2008, Reg. No. 6044, with original R.R. (4) Original Office Order No. AM/ABD/ALT/FR/TW/PLT/5171 issued by GIDC in favour of M/s. Mission Engineers a Proprietorship Firm, dated 02/09/2008 have been lost / misplaced by the aforesaid present owner/Lease Holder namely M/s. Mission Engineers a Proprietorship Firm. There fore the present notice for inviting objections or having any claim in respect of the above referred property by way of sale, lease, exchange, gift, mortgage, charge, inheritance, possession, lien, hypothecation, transfer of title or beneficial interest under any trust – right of pre-emption or prescription under any agreement or under any decree, order or award of the any court or otherwise claiming howsoever are hereby requested to inform the same in writing to the undersigned at their office address as mentioned below, within 7 (Seven) days from the date of the publication hereof, failing which, the claim or claims if any of such person or persons will be considered/or deemed to have been waived and/or abandoned, and the title clearance certificate will be issued with regard to the aforesaid property after completion of the said notice period, and thereafter no claim or claims will be entertained of any such person or persons with regard to the aforesaid property. **Date: 15/05/2024**

Viren G. Dave (Advocate) • For, CMD Advocates & Associates
Office: B-306, Dev Aarum, Nr. Anandnagar Cross Road, Shyamal-Prahladnagar-100ft. Road, Satellite, Ahmedabad-380015., No. 9426743055

केनरा बैंक केनरा बैंक Canara Bank

General Administration Section, Circle Office, 7th Floor, Gift One Building, Gift City, Gandhinagar-382355. Ph.: 079-69027786, Email : premisescoahd@canarabank.com

REQUIREMENT OF NEW PREMISES SPACE FOR NEW BRANCHES OF CANARA BANK

Canara Bank require premises for the following branch on rental basis, preferably on Ground floor, Strong room is to be constructed as per Bank's requirement by landlord. All Tax to be borne by the landlord only.

Place	Taluka	District	Area (Carpet Area) in sqft	POP GP
Bakrol Bajrang	Daskroi	Ahmedabad	1200-1500	RURAL
Vijapur	Vijapur	Mehsana	1500-1700	SEMI URBAN
Ahmedabad Shahibaug	Ahmedabad	Mehsana	1700-1900	METRO
Sachin	Chorasi	Surat	1500-1700	SEMI URBAN
South Bopal	Daskroi	Ahmedabad	1500-1700	SEMI URBAN
Dabhoi	Dabhoi	Vadodara	1500-1700	SEMI URBAN
Bhatar	Surat	Surat	1500-1700	URBAN
KIM	Olpad	Surat	1500-1700	URBAN
Piplod	Surat	Surat	1500-1700	URBAN
Sanand Motipura	Sanand	Ahmedabad	1500-1700	SEMI URBAN
Sayan	Olpad	Surat	1500-1700	SEMI URBAN

Please visit our website : www.canarabank.com for details of bid documents. The Bid documents are to be downloaded from our website. Tenders are to be submitted at above office latest by 2:00 P.M on or before 06.06.2024. Further communication and amendment, if any, will be posted in bank website only. **Bank deals with landlord directly. Brokers excuse. Bank reserves the right to accept or reject any or all the offers without assigning any reason whatsoever.**

Place : Gandhinagar
Date : 15.05.2024

Sd/- Asst. General Manager
CO, Ahmedabad



RM C HOWK BRANCH :
Nr. Municipal Corporation,
Dhebar Road, Rajkot - 360001

APPENDIX IV (See Rule 8(1)) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas The undersigned being the Authorised Officer of Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice Dated 09.02.2024 calling upon the Borrower Mr. Shaileshbhai Batukbhai Sabhaya (Borrower) & Mrs. Riddhiben Shaileshbhai Sabhaya (Co-Borrower) having Residential Address : Residential Flat No. 106, on the 1st Floor having Build up Area 53.088 Sq. Mtrs. & Carpet Area 44.24 Sq. Mtrs. in Residential Building known as Aarya Kruti Apartment, Shivajay Park, B/H H.P. Petrol Pump, Off. Morbi Road, Rajkot constructed on total land adm. about 1182.51 Sq. Mts. of Plot No. 63, 64 and 65 of total land adm. 10122.00 Sq. Mts. Allotted in Final Plot No. 29 and 47 of Town Planning Scheme No. 12 of Revenue Survey No. 90 palki 1 and 90/3 palki 7 of Rajkot area known as Shivajay Park, it is a part and parcel of City Survey No. 3152/1/1/01/106/7 of City Ward No. 13/2, At. Rajkot District in the state of Gujarat presently in Rajkot Municipal Corporation Rajkot in the state of Gujarat to repay the amount mentioned in the notices aggregating Rs. 17,82,181.23 (Rupees Seventeen Lakh Eighty Two Thousand One Hundred Eighty One and Paise Twenty Three Only) + unapplied Interest and other charges as on 09-02-2023 together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment with less recovery within 60 days from receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 of the said Act on this the 10th day of month May of the year 2024.

The Borrower / Partners / Guarantors / Mortgagees in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with property will be subject to the charge of the Bank of Baroda for an amount of Rs. 17,82,181.23 (Rupees Seventeen Lakh Eighty Two Thousand One Hundred Eighty One and Paise Twenty Three Only) + unapplied Interest and other charges and further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment with less recovery if any.

The Borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

Residential Flat No. 106 on the 1st Floor having Build up area 53.088 Sq. Mts. & Carpet area 44.24 sq. mts. in Residential Building known as Aarya Kruti Apartment, Shivajay Park, B/H H.P. Petrol Pump, Off. Morbi Road, Rajkot constructed on total land adm. about 1182.51 Sq. Mts. of Plot No. 63, 64 and 65 of total land adm. 10122.00 Sq. Mts. Allotted in Final Plot No. 29 and 47 of Town Planning Scheme No. 12 of Revenue Survey No. 90 palki 1 and 90/3 palki 7 of Rajkot area known as Shivajay Park, it is a part and parcel of City Survey No. 3152/1/1/01/106/7 of City Ward No. 13/2, At : Rajkot District in the State of Gujarat, presently in Rajkot Municipal Corporation, Rajkot in the State of Gujarat in the name of Mr. Shaileshbhai Batukbhai Sabhaya (Borrower) & Mrs. Riddhiben Shaileshbhai Sabhaya (Co-Borrower) The Boundaries are as under:
North : O.T.S. East : Flat No. 101
South : Lift and Passage West : Flat No. 105
Date : 10.05.2024, Place : Rajkot Authorised Officer, Bank Of Baroda

Panasonic

Panasonic Energy India Co. Ltd.

CIN: L31400GJ1972PLC002091
Regd. Office: G.I.D.C., Makarpura, Vadodara-390010.
Tel No. (0265) 2642661
Website: www.panasonicenergyindia.in
Email ID: company.secretary@in.panasonic.com

NOTICE

NOTICE is published pursuant to the provisions of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 notified by the Ministry of Corporate Affairs effective from September 7, 2016.

The Rules, amongst other matters, contain provisions for transfer of all such shares in respect of which dividend has not been claimed for seven consecutive years to Investor Education and Protection Fund (IEPF).

Notice is further given that in accordance with the provisions of the rules, individual notices have already been sent to respective shareholders at their latest available address in the company records, whose shares are liable to be transferred to IEPF under the said rules for taking appropriate action(s).

The company has also uploaded full details of such shareholders and shares due for transfer to IEPF on its website at <https://www.panasonicenergyindia.in>. The details covering such shares in respect of which the dividend has not been claimed by the shareholders for seven consecutive years from 2016-17.

In case the company does not receive any communication from the shareholder by July 15, 2024 or any other date as decided, the company shall with a view to comply with the requirement set out in the rules, transfer the shares to IEPF by the due date as per procedure stipulated in the rules.

In case the shareholder wish to claim the shares after transfer to IEPF, a separate application can be made to the IEPF Authority, in Form IEPF-5, as prescribed under rules and which is available at the IEPF website i.e. www.iepf.gov.in.

In case the shareholders have any queries on the subject matter and rules, they may contact the Company or the Company's Registrar and Share Transfer Agent Link Intime India Pvt. Ltd. Tel.: (0265) 3566768, Email: vadodara@linkintime.co.in

For Panasonic Energy India Co. Ltd.

Date: May 15, 2024
Place: Vadodara

Sd/-
Sraban Kumar Karan
Company Secretary

The Only battery company in India Manufacturing 100% Eco-friendly Batteries



Branch Office: ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug, Near Dharam Cinema, Rajkot- 360001.

PUBLIC NOTICE - TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET

(See proviso to rule 8(6))

Notice for sale of immovable assets

This E-auction Sale notice for sale of Immovable assets is being issued by ICICI Bank Ltd. (on underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance Ltd.) in relation to the enforcement of security in respect of a housing loan facility granted pursuant to a loan agreement entered into between DHFL and the following borrower(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the Physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Ltd. will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" as per the brief particulars given hereunder;

Sr. No.	Name of Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding (D)	Reserve Price Earnest Money Deposit (E)	Date and Time of Property Inspection (F)	Date & Time of E-Auction (G)
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Maheshbhai Ghanashyambhai Hemani (Borrower) / Ghanashyambhai Tolaram Hemani (Co-Borrower) Loan A/c No. QZRAJ00005064381.	Flat No. 11/12, 4th Floor, Raviraj Apartment, Talav Darwaja, Street No. 3, Block No. 13, C.S. No. 199, Vanthli Highway, Junagadh- 362001. Admeasuring Built-up area 69.71 Sq. Mtr.- Free Hold Property	Rs. 37,20,668/- (as on May 10, 2024)	Rs. 9,85,000/- Rs. 99,000/-	May 24, 2024 11:00 AM To 12:00 Noon	June 07, 2024 From 11:00 AM Onwards
2.	Pareshkumar Balabhai Kodyatar (Borrower) / Kiranben Pareshbhai Kodyatar (Co-Borrower) Loan A/c No. QZRAJ00005064386	Flat No. 106, 1st Floor, Western Plaza, Plot No. 22 To 24, Survey No. 233/1P, Western Park, Vanthali Road, Shapur, Junagadh- 362205. Admeasuring an area of 691.92 Sq. Ft.-Free Hold Property	Rs. 20,14,792/- (as on May 10, 2024)	Rs. 8,21,000/- Rs. 83,000/-	May 24, 2024 12:00 Noon To 01:00 PM	June 07, 2024 From 11:15 AM Onwards
3.	Shilpeshkumar Dhiraajmal Dhoroda (Borrower) / Deepa S Dhoroda (Co-Borrower) Loan A/c No. QZRAJ00005036041	Flat No. 302, Abhishek Apartment, Plot No. 40-F, Gopal Nagar, Street No. 10/1, Dhebarbhai Road, Gujarat, Rajkot-360001. Admeasuring Built up area 33.24 Sq. Mtr.- Free Hold Property	Rs. 20,10,859/- (as on May 10, 2024)	Rs. 12,35,000/- Rs. 1,24,000/-	May 24, 2024 01:00 PM To 02:00 PM	June 07, 2024 From 11:30 AM Onwards

The online auction will take place on the website of e-auction agency **M/s NexXen Solutions Private Limited**. (URL [Link-https://disposalhub.com](https://disposalhub.com)). The Mortgagees/ Noticee are given last chance to pay the total dues with further interest till **June 06, 2024 before 04:00 PM** failing which, this/these secured asset(s) will be sold as per schedule.

The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at **ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug, Near Dharam Cinema, Rajkot- 360001** or before **June 06, 2024 before 03:00 PM** and thereafter they need to submit their offer through the above mentioned website only on or before **June 06, 2024 before 04:00 PM** along with scan image of Bank acknowledged DD towards proof of payment of EMD. Kindly note, in case prospective bidder(s) are unable to submit their offer through the website then signed copy of tender documents may be submitted at **ICICI Bank Limited, Jayhind Annex, Opp. Sharda Baug, Near Dharam Cinema, Rajkot- 360001** on or before **June 06, 2024 before 05:00 PM** Earnest Money Deposit DD/PO should be from a Nationalised/Scheduled Bank in favour of "ICICI Bank Limited" payable at Rajkot.

For any further clarifications with regards to inspection, terms and conditions of the E-auction or submission of tenders, kindly contact **ICICI Bank Limited on 8356846884**.

Please note that Marketing agencies 1. **M/s NexXen Solutions Private Limited** 2. **Augeo Asset Management Private Limited** have also been engaged for facilitating the sale of this property.

The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.

For detailed terms and conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

Date: May 15, 2024
Place: Rajkot & Junagadh

Authorized Officer
ICICI Bank Limited



HDFC Bank Ltd.

POSSESSION NOTICE

Branch : HDFC Bank Limited, Trident,
Race Course, Vadodara-390007. Tel. : 079-64807999

Whereas the Authorised Officer/s of HDFC Bank Ltd. (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT/Mumbai vide order dated 17th March 2023) under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13(2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice(s), incidental expenses, costs, charges etc. till the date of payment and / or realisation.

Sr. No.	Name of Borrower(s)/ Legal Heir(s)/ Legal Representative(s)	Outstanding Dues Rs. As on Dt.*	Date of Demand Notice	Date of Possession Physical/ Symbolic	Description of Immovable Property(ies)/ Secured Asset(s)
(a)	(b)	(c)	(d)	(e)	(f)
1	MR. KAUSHIKKUMAR HIMATBHAI VASAVA (Borrower) 142524-622312812 & 622091913	Rs. 31,907/- And Rs. 15,24,808/- Respectively as on 30-Apr., 2022*	31-May, 2022	10-May, 2024 Symbolic Possession	PLOT-16, VRUNDAVAN ROW HOUSE, S. NO. 150, VILLAGE-VADIA, KARATHA ROAD, NR. SAI DARSHAN, RAJPIPLA, BHARUCH-393145.
2	MR. HITENDRASINH BARAD (Borrower) Mr./Mrs./Ms./Wife/Son/Husband/ Daughter of MR. CHANDRASINH BARAD (Co-Borrower) [Since Deceased] and other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MR. CHANDRASINH BARAD (Co-Borrower) [Since Deceased] 75799-629016034 & 626278758	Rs. 1,05,510/- And Rs. 31,52,033/- Respectively as on 31-May, 2022*	27-Sep., 2022	10-May, 2024 Symbolic Possession	DUPLEX-8, RAMESHWARAM BUNGLOWS, S. NO. 148, NEAR SAI DARSHAN BUNGLOWS, VADIA TEEN RASTA, VADIA VILLAGE, NARMADA-393145.
3	MRS. CHANDANBEN BARIYA (Borrower) MR. DIPTESHKUMAR VASAVA (Co-Borrower) 163970-636378930	Rs. 20,35,915/- as on 30-June, 2023*	08-Aug., 2023	10-May, 2024 Symbolic Possession	8, SAI DARSHAN RESIDENCY, R. S. 146/P, PLOT 1 TO 62, VADIA THREE ROADS, KARATHA ROAD, VILLAGE-VADIA, RAJPIPLA-393145.
4	MR. CHANDUBHAI GALABHAI DAMOR (Borrower) 168765-661866994 & 665133649	Rs. 6,54,572/- And Rs. 52,031/- Respectively as on 31-Dec., 2023*	19-Jan., 2024	10-May, 2024 Symbolic Possession	TENEMENT-C-170, SAMRUDDHI PARK, (R. S. NO. 30311 + 2, 30313), BHADKODARA-VALIA ROAD, ANKLESHWAR-393002.
5	Wife/Son/Daughter/Husband of Mr./Mrs./Ms. JAGDISHBHAI R. DUDHAT [Since Deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of Mr./Mrs./Ms. JAGDISHBHAI R. DUDHAT [Since Deceased] (Borrower) MRS. ANJANA JAGDISHKUMAR DUDHAT (Co-Borrower) 168519 - 636058638, 663650605	Rs. 22,56,608/- And Rs. 3,80,932/- Respectively as on 31-Dec., 2023*	02-Jan., 2024	10-May, 2024 Symbolic Possession	74, VRAJ VILLA, R. S. 615, NR. KOLI PATEL SAMAJ WADI, OPP. BHAVYA RESIDENCY, HANSOT ROAD, ANKLESHWAR-393001.
6	MR. RAMPAL MANGALAL SALUNKHE (Borrower) MRS. MEENA RAMPAL SALUNKHE (Co-Borrower) 172671-643578239	Rs. 36,52,930/- as on 31-Dec., 2023*	22-Jan., 2024	10-May, 2024 Symbolic Possession	DUPLEX-217, MALHAR GREEN CITY BUNGLOWS, S. NO. R. S. 125/3/1, 125/3, 127/1, SHRAVAN CHOKADI, DAHEJ BY PASS ROAD, NR. NARAYAN SHRUSHTI, OPP. GAIL TOWN SHIP, NANDEVAR, BHARUCH-392001.
7	MR. AMITKUMAR ASHOK SHARMA (Borrower) MRS. REKHA LALITBHAI HELIA (Co-Borrower) 172674-670648208	Rs. 24,70,929/- as on 31-Dec., 2023*	22-Jan., 2024	10-May, 2024 Symbolic Possession	FLAT-302, 3RD FLOOR, AMITY ENCLAVE BLDG-A "FLORA", PLOT NO.-53 TO 58, R. S. NO. 114, UMRJA, NEAR SHRAVAN CHOKDI, DAHEJ ROAD, NEAR AMITY SCHOOL, BHARUCH-392001.
8	MR. RAJESH HARJIVANDAS DAVADA (Borrower) MRS. NIRUBEN HARJIVANBHAI DAVDA (Co-Borrower) 172582-633305708 & 633306204	Rs. 9,29,647/- And Rs. 3,28,077/- Respectively as on 31-Dec., 2023*	22-Jan., 2024	10-May, 2024 Symbolic Possession	DUPLEX-A/307, SAI GARDEN BUNGLOWS, S. NO. OLD S. NO. 174, R. S. NO. 174, NEAR HALDARVA GEB SUB STATION, OSARA ROAD, NH-8, BHARUCH-392001.
9	MR. FUARAM CHOUDHARI (Borrower) MRS. PUSHPA CHAUDHARI (Co-Borrower) 168762-642131846 & 643726269	Rs. 10,35,268/- And Rs. 78,525/- Respectively as on 31-Dec., 2023*	02-Jan., 2024	10-May, 2024 Symbolic Possession	FLAT-B-303, 3RD FLOOR, VALLABH SRUSHTI CO. OP. HOU. SOC. LTD., PLOT-H-3093/7, S. NO. 276 & 556/P, NR. ESIC HOSPITAL, 500 QUARTER ROAD, GIDC, ANKLESHWAR-393002.
10	MR. KAMLESHBHAI UMARBHAI KADIWALA (Borrower) MRS. MUMTAZBEN KAMLESHBHAI KADIWALA (Co-Borrower) 168761-634157920 & 634404390	Rs. 14,11,433/- And Rs. 1,07,310/- Respectively as on 31-Dec., 2023*	22-Jan., 2024	10-May, 2024 Symbolic Possession	ROW HOUSE-43, GREEN GOLD HOMES, S. NO. 205, BLOCK-205, OPP. LAHERI C

